

GANESH BENZOPLAST LIMITED

CIN: L24200MH1986PLC039836 PAN NO. AAACG1259J

Regd. Office: Dina Building, 1st Floor, 53, Maharshi Karve Road, Marine Lines, Mumbai - 400 002 Tel: 022- 61406000 Fax: 022-22001928

Email: compliance@gblinfra.com

Website: www.ganeshbenzoplast.com

May 31, 2024

To,

The General Manager,	The Manager,						
Department of Corporate Services -	Listing Department						
Corporate Relations Department,	National Stock Exchange of India						
BSE Limited,	Limited						
Pheeroze Jeejeebhoy Towers,	Exchange Plaza, 5th Floor,						
Dalal Street, Fort,	Plot No. C/1, G-Block, Bandra Kurla						
Mumbai – 400 001.	Complex,						
	Bandra (E), Mumbai – 400051						
Scrip ID: 500153	Scrip ID: GANESHBE						

Dear Sir,

Sub: Intimation of Publication of Audited Financial Results in Newspapers

Pursuant to Regulation 33, 47 and other applicable Regulations of SEBI (LODR) Regulations, 2015, the Audited Financial Statement (Standalone and Consolidated) for the quarter and year ended March 31, 2024 was duly published in the following newspapers:

The Business Standard, Mumbai Lakshadeep & Mumbai Samachar dated May 31, 2024.

The copy of published notice is enclosed for your reference.

You are requested to take the above information on records and oblige.

Thanking you, Yours Faithfully, For Ganesh Benzoplast Ltd.

Ekta Dhanda Company Secretary and Compliance Officer

Encl: As above



ONE GLOBAL SERVICE PROVIDER LIMITED CIN: L74110MH1992PLC367633

Reg Office: 6th Floor, 601 E Wing, Trade Link Building, B & C Block Senapati Bapat Marg, Kamala Mill Compound, Lower Parel (W) Delisle Road, Mumbai, Maharashtra - 400013. E-mail: 1connect@1gsp.in website: www.1gsp.in AUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON MARCH 31, 2024

٥.		Q	UARTER END	YEAR ENDED		
Sr. No.	Particulars	31-03-2024	31-12-2023	31-03-2023	31-03-2024	31-03-2023
		AUDITED	UNAUDITED	AUDITED	AUDITED	AUDITED
1.	Total Revenue from Operations	2,430.29	1,454.04	533.68	6,301.11	1,811.63
2.	Profit/(Loss) before Exceptional Items and Tax	532.59	194.97	43.08	949.97	135.6
3.	Profit/(Loss) before Tax	532.59	194.97	43.08	949.97	135.6
4.	Profit/(Loss) after Tax	397.42	146.28	43.73	710.88	137.92
5.	Total Comprehensive Income	397.42	146.28	43.73	710.88	137.92
6.	Paid up Equity Share Capital (FV Rs. 10 per Sh.) 710.47	710.47	710.47	710.47	710.47
7.	Other Equity	-	•	•	729.52	18.64
8.	Earnings per share in Rs. From					
	continuing operations 1. Basic:	5.59	2.06	0.62	10.01	1.94
	2. Diluted	5.59	2.06	0.62	10.01	1.94

Note: (A) The above is an extract of the detailed format of Quarter and year ended 31.03.2024 results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the results are available on the websites of the Stock Exchange(s) and the listed entity www.1gsp.in (B) The impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies shall be disclosed by means of a footnote. (C) Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules / AS Rules, which On Behalf of Board of Director

For ONE GLOBAL SERVICE PROVIDER LIMITED

Sanjay Upadhaya - Managing Director

SUDAL INDUSTRIES LIMITED

CIN:L21541MH1979PLC021541

Registered office: A-5, MIDC, Ambad Industrial Area, Nashik - 422 010. Corporate office: 26A, Nariman Bhavan , 227 Nariman Point, Mumbai - 400 021

Audited Financial Results for the Quarter and Year Ended March 31, 2024

					Rs in lakhs
		Quarter Ended		Year e	ended
Particulars	March 31, 2024	December 31, 2023	March 31, 2023	March 31, 2024	March 31, 2023
	Audited*	Unaudited	Audited [*]	Audited	Audited
Total Income from Operations (Net)	3,488.71	3,325.71	4,044.43	14,419.49	16,170.72
Net Profit / (Loss) from ordinary activities before tax and exceptional items and extra- ordinary items	178.30	(17.78)	(1,124.19)	(359.40)	(3,089.66)
Net Profit / (Loss) from ordinary activities before tax after exceptional items and extra- ordinary items	178.30	(17.78)	(1,124.19)	12,181.57	(3,337.82)
Net Profit / (Loss) from ordinary activities after tax, exceptional items and extra-ordinary items	114.39	(17.78)	(1,124.19)	12,117.66	(3,337.82)
Total Comprehensive Income for the period	115.38	(17.78)	(1,113.88)	12,118.66	(3,327.51)
Equity Share Capital (Face value of Rs. 10 each)	836.78	836.78	736.78	836.78	736.78
Other Equity excluding revaluation reserve as per the latest audited balancesheet				1,088.95	(11,029.70)
Earnings Per Share of `Rs. 10 each for continuing operations					
Basic & Diluted	1.37	(0.21)	(15.26)	152.01	(45.30)
Notes :					

- 1(a) During the year ended March 31, 2024,the Company's Prepackage Insolvency Resolution Plan (PIRP) was approved by Hon'ble NCLT, Mumbai vide its Order dated August 10, 2023. Consequently, the Company has written back liabilities in respect of principal and Interest aggregating to Rs. 12540.97 lakhs (including interest of Rs.690.77 lakhs for the period from April 1, 2023 to June 30, 2023) and disclosed the same as exceptional items. The Company has been continuously incurring losses over last several years However, there was net profit after comprehensive income of Rs. 115.38 lakhs for the current quarter ended March 31, 2024 and Rs. 12,118.66 lakhs for the year ended March 31, 2024 In view of the aforesaid settlement). Being post settlement imely payment of the installments to the lender in compliance with aforesaid NCLT Order and also expected better operational performance in future, the management believes that it is appropriate to prepare these financial statements on a going concern basis.
- One of the unsecured lender of Rs.1243.39 lakhs (as mentioned in the aforesaid NCLT Order) which has been settled for Rs. 2.46 lakhs as per NCLT Order filed an appeal before the Hon'ble National Company Law Appellate Tribunal (NCLAT), Delhi praying for reversal of the aforesaid Resolution Plan. Based on the expert opinion, the Company expects favourable outcome in this regard.
- The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges unde Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on stock exchange website www.bseindia.com and on the Company's website

For and on behalf of the Board For Sudal Industries Limited M. V. Ashar Whole Time Director

Place : Mumbai Date: May 30, 2024

> Recovery and Sales Officer, Co-operative Society, Maharashtra State by Shri Kulswami Co-op Credit Society Ltd.

Head Office: F-3/1 floor, APMC Fruit Market, Central Facility Building, 19, Vashi, Navi Mumbai- 400705 Phone: -27831007, 27831027 "NAMUNA 'Z' "

Notice of possession of immovable property (Rule 107 sub rule (11(D-1))

Where by Shri Kulswami Co-op. Cr. so. Ltd, under the section 101 of The Maharashtra Co-operative Societies Act, 1960, for the recovery of loans against defaulter has obtained the mandate. The Recovery Officer of the Shri Kulswami Co-op. Cr. so. Ltd is implementing the order in connection with the recovery of loans against the debtors. The said loan is to be recovered only by selling the following immovable property of defaulter.

Accordingly, the Recovery and Sales Officer signed below has issued **Demand Notices** to the defaulter under Section 156 of the Maharashtra Co-operative Societies Act, 1961 and Prior to confiscation notice has been issued and the immovable property specified below has already been confiscated by immovable confiscation order. Defaulter did not paid full amount of loan hence the notice is given to defaulter as below. As per the authority given to me as a Recovery and Sales Officer the authority of Maharashtra Co-operative Societies Act 1960 and Rule 1961 of 156 and Rule 107 (11 (D-1)). Property cannot be sold without permission.

In particular, the defaulter and all the citizens are cautioned not to make any transaction regarding the immovable property specified below and in case of transaction, the total amount of loan till the recovery of the loan, interest other expenses and Aadeshika expenses incurred will have to be subject to the total amount. The descriptions of the immovable property acquired are as follows:

DESCRIPTION OF IMMOVABLE PROPERTY

Borrowers / Landlord	Maharashtra Co-operative Societies Act, 1960 Action as per Section 156 Rule 107	Recovery Award No/ Date	Description of immovable property
Defaulter No. 1) Mr. Kishor Otarmal Jain 2) Mrs. Sangita Kishor Jain 3) Mr. Rajkumar Shantilal Pitani 4) Mr. Kiran Amrutlal Jain	1)Demand Notice Date 18/12/2023 2) Pre Confiscation demand Notice Date- 08/01/2024 3) Immovable Confiscation Order Date- 23/04/2024	Recovery Award No. 6112/2023 Date-10/11/2023	Mortgaged property in the name of Defaulter Mr. Kishor Otermal Jain, 1) Rabgaon Gram Panchayat, Tal. Sudhagad, Dist. Raigad- 410205 City Survey No. 5/15 (Area 0.ha 74.0R) Size Rs. 1.12 2) At. Po. Nehuli, Ta. Alibaug, Dist. Raigad Non-Agriculturalm Survey No.1/1A41/2B, in Project Bay Castle Building No. F, B Wing, Ground Floor, Sadanika No. 001, Area 363 Sq.Foot, Carpet Group Gram Panchayat No. 1 F/B 001 3) At. Po. Goulawadi, Ta. Roha, Dist. Raigad -402308. Agricultural land group no. 53/1 (Area 1 Ha. 14.0 R) Mortgaged Property
Defaulter No. 1) Mr. Rupesh Ramdas Mahadik 2) Mr. Dattu Aappa Gawali 3) Mr. Santosh dattu Gawali (Panvel Branch)	Demand Notice Date- 11/07/2018 Pre Confiscation demand Notice Date- 28/07/2018 Immovable Confiscation Order Date-07/02/2023	Recovery Award No. 1517/2018 Date - 22/06/2018	Immovable property in the name of Defaulter Mr. Rupesh Ramdas Mahadik and his father Mr. Ramdas Babaji Mahadik and his father Mr. Babaji Dhondu Mahadik Agricultural land At. Po. Devpur, Tal. Poladpur, Dist. Raigad -402303 Group no. 54/13 (Area 0. He.03.50 sq.m), 8/12B (Area 0. He.01.00 sq.m), 7/18 (Area 0. He 02.00 sq.m.) A common share in this
Defaulter No. 1) Mr. Mohan Pandurang Naik 2) Mrs. Surekha Dayanand Shewale 3) Mr. Aakaram Dhyanu Aamale (Kalachuki Branch)	Demand Notice Date 13/01/2014 Pre Confiscation demand Notice Date 17/02/2017 Immovable Confiscation Order Date- 08/07/2021	Recovery Award No. 1187/2013 Date- 08/10/2013	Immovable property in the name of Defaulter Mr. Mohan Pandurang Naik Agricultural land At. post. Shighre, Tal. Murud, Dist. Raigad - 402401 Group no. 191 (area 0 is 0.02 sq.m.) in common share

The possession notice was given on 29/05/2024 with my signature and office stamp.

O.W. NO. - 117/2024-25 Location : - Vashi, Navi Mumbai Date - 29/05/2024



Mr. R.B. Tajne Recovery and Sales officer By Shri Kulswami Co-op, Credit Soc, Itd



GANESH BENZOPLAST LIMITED

Regd. Office : Dina Building, 1st Floor, 53, Maharshi Karve Road, Marine Lines (East), Mumbai 400 002. **CIN :** L24200MH1986PLC039836 **Telefax:** 022-22001928 **e-mail :** investors@gblinfra.com **web-site :** www.ganeshbenzoplast.com

EXTRACT OF STATEMENT OF AUDITED STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2024

	₹ in Millions (Except EPS)											
			STANDALONE					CONSOLIDATED				
Sr	Particulars	Quarter Ended			Year E	inded	Quarter Ended			Year Ended		
No	i ai ilvuiais	31.03.2024	31.12.2023	31.03.2023	31.03.2024	31.03.2023	31.03.2024	31.12.2023	31.03.2023	31.03.2024	31.03.2023	
		AUDITED	UNAUDITED	AUDITED	AUDITED	AUDITED	AUDITED	UNAUDITED	AUDITED	AUDITED	AUDITED	
1	Total Income From Operations	602.47	590.29	517.84	2,267.15	1,926.92	1,462.64	1,061.96	1,340.67	4,770.77	4,208.48	
2	Net Profit for the period (before tax and Exceptional items)	220.51	208.82	167.42	815.73	684.88	208.96	208.04	199.76	839.91	745.57	
3	Net Profit for the period (before tax and after Exceptional items)	220.51	208.82	164.21	815.73	681.66	208.96	208.04	196.51	839.91	742.32	
4	Net Profit for the period (after tax and after Exceptional items)	161.89	157.93	122.60	606.25	509.37	142.91	160.80	147.47	614.41	550.79	
5	Total Comprehensive Income for the period	165.37	157.17	122.27	609.47	507.77	146.18	159.48	147.13	616.86	548.96	
6	Equity Share Capital (Face value of Re. 1/- each)	71.99	68.11	65.18	71.99	65.18	71.99	68.11	65.18	71.99	65.18	
7	Reserve excluding Revaluation reserves as shown in the audited balance sheet				4,922.80	3,483.00				4,944.17	3,503.31	
8	Earning Per Share (of Re. 1/- each) (not annualised) (after Exceptional items)											
	a) Basic	2.30	2.31	1.88	8.95	8.08	2.03	2.34	2.44	9.07	8.73	
	b) Diluted	2.30	2.31	1.85	8.95	7.93	2.03	2.34	2.40	9.07	8.57	

Note:

- 1. The above is an extract of the detailed format of Financial Results for the Quarter and year ended on March 31, 2024 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Audited Financial Results are available on the Company's website, www.ganeshbenzoplast.com and and Stock Exchanges website. www.bseindia.com and www.nseindia.com
- 2. The above financial results have been reviewd and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at their meeting held on 30th May, 2024

For Ganesh Benzoplast Limited (Rishi Pilani) Chairman & Managing Director (DIN 00901627)

Place: Mumbai Date : May 25, 2024

Panacea Biotec Innovation in support of life

Extract of Standalone and Consolidated Financial Results (Audited) for the Quarter and Year Ended March 31, 2024

(Rs. in Lakh except per share)

		9	Standalone	1		Consolidated				
	Q	uarter Ende	ed	Year E	nded	Q	uarter Ende	d	Year E	nded
Particulars	March	December	March	March	March	March	December	March	March	March
	31, 2024	31, 2023	31, 2023	31, 2024	31, 2023	31, 2024	31, 2023	31, 2023	31, 2024	31, 2023
	Audited	Unaudited	Audited	Audited	Audited	Audited	Unaudited	Audited	Audited	Audited
	(Refer note 3)		(Refer note 3)			(Refer note 3)		(Refer note 3)		
Total income from operations	8,037	9,523	7,502	35,960	25,707	13,646	15,050	12,893	55,917	45,995
Net Profit / (Loss) for the period/year (before tax,										
exceptional and/or extraordinary item)	(135)	107	510	421	(6,275)	(486)	(443)	(117)	(3,455)	(8,986)
Net Profit / (Loss) for the period/year before tax (after										
exceptional and/or extraordinary item)	(135)	107	510	421	(6,275)	(212)	(165)	1,821	148	1,280
Net Profit / (Loss) for the period/year after tax (after										
exceptional and/or extraordinary item)	(137)	43	(1,969)	355	(8,754)	(199)	(220)	(1,268)	(150)	(3,375)
Total comprehensive income/(loss) for the period/year										
(comprising of profit/(loss) for the period/year (after tax)										
and other comprehensive income (after tax))	(143)	43	(2,149)	349	(8,944)	(268)	(211)	(1,186)	(189)	(3,354)
Equity Share Capital (face value of Re.1 per share)	613	613	613	613	613	613	613	613	613	613
Earning/(loss) per equity share, (annualised, except for										
quarters): Basic and Diluted	(0.22)	0.07	(3.21)	0.58	(14.29)	(0.23)	(0.37)	(2.03)	(0.19)	(5.43)

Notes: 1. The above is an extract of the detailed format of Quarterly and Year Ended Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly and Year Ended Financial Results is available on the Stock Exchanges websites, NSE- http://www.nseindia.com, BSE- http://www.bseindia.com and is also available on the Company's website, http://www.panaceabiotec.com. 2. The above financial results were reviewed by the Audit Committee of the Board and approved by the Board of Directors at their meetings held on May 29, 2024 and May 30, 2024 respectively. 3 Amounts for the quarters ended March 31, 2024 and March 31, 2023 represent the balancing amounts between the audited amounts for the full financial year and published year to date amounts upto the third quarter of the respective financial years, which had been subjected only to limited review. 4 The financial results have been prepared in accordance with the recognition and measurement principles of applicable Indian Accounting Standard ("Ind-AS") notified under the Companies (Indian Accounting Standards) Rules, 2015 as specified in section 133 of the Companies Act, 2013. 5. Previous period / year amounts have been regrouped/reclassified to make them comparable with those of current period/year For and on behalf of the Board of Directors of

Panacea Biotec Limited

Place : New Delhi Date: May 30, 2024

Panacea Biotec Limited Regd. Office: Ambala-Chandigarh Highway, Lalru - 140501, Punjab **Chairman & Managing Director**

Ph. No. 91-11-41679000, Fax: 91-11-41679070, CIN: L33117PB1984PLC022350 Website: http://www.panacea-biotec.com, E-mail: corporate@panaceabiotec.com



UDAYSHIVAKUMAR INFRA LIMITED

CIN: L45309KA2019PLC130901 (Formerly known as Udayshivakumar Infra Private Limited) Registered Office: # 1924/A-196, "Manjukrupa", Banashankari Badayane, Near NH-4 Bypass, Dayangere - 577005, Karnataka Website: www.uskinfra.com, Email: cs@uskinfra.com, Phone: 08192-297009 Statement of Audited Financial Results for the Quarter Ended and Year Ended March 31, 2024

(Rs. in lakhs)

SI			Quarter Ended		Year to Date			
No.	Particulars	31-03-2024 (Audited)	31-12-2023 (Unaudited)	31-03-2023 (Audited)	31-03-2024 (Audited)	31-03-2023 (Audited)		
1.	Total Income from Operations	15,939.47	16,087.22	12,143.79	57,714.78	28,689.81		
2.	Net Profit for the period before tax (after exceptional and extraordinary items)	1,849.85	876.38	615.93	4,079.97	2,151.30		
3.	Net Profit for the period after tax (after exceptional and extraordinary items)	1,387.38	605.10	467.16	3,012.81	1,604.72		
4.	Total Comprehensive Income for the period (Comprising Profit for the period (after tax) and other Comprehensive Income (after tax)	53.00		-2.15	53.00	-2.09		
5.	Equity Share capital (Face value Rs. 10)	5,535.71	5,535.71	5,535.71	5,535.71	5,535.71		
6.	Other Equity	NA	NA	NA	11,956.85	8,883.59		
7.	Earning per share(of Rs. 10/- each) (not annualised): Weighted average number of equity shares used as denominator for calculating EPS (Nos.) (a) Basic EPS	5,53,57,142 2.60	5,53,57,142 1.09	3,66,54,990 1.27	5,53,57,142 5.54	3,66,54,990 4.37		
	(b) Diluted EPS	2.60	1.09	1.27	5.54	4.37		

Note: The above is an extract of the detailed format of Financial Results filed with BSE Limited under Regulation 33 of SEBI (Listing Obligations and disclosure requirements), Regulation, 2015. The complete format of Financial Results are available on the website of BSE Limited (www.bseindia.com) and on the website of our Company (www.uskinfra.com).

For and on behalf of the Board of Directors Udayshivakumar Infra Limited

Sd/-

Mr.Udayshivakumar Managing Director DIN: 05326601









Place: Davangere, Karnataka

Date - 30-05-2024











भंडारा जिल्ह्याचे आजचे तापमान ४५ अंश सेल्सिअस पोहचला आहे. रस्ते निर्मन्तस्य झाले असुन नागरिकांनी घराबाहेर पडू नये असा

सल्ला दिला जातो. अश्या परिस्थिती उन्हाचा त्रास होऊन लोक आजारी पडून लागले आहेत. अश्यातच या उस्माघाताचा पहिला बळी गेला आहे. भंडारा जिल्ह्याच्या लाखांदर

येथील ५१ वर्षीय व्यक्तीचा मृत्यू झाला आहे. मृतकाचे नाव भास्कर तरारे असे नाव आहे. आज घडीला एकूण पाच राग्ण जिल्हा सामान्य राग्णालयाला दाखल आहेत

WAGEND INFRA VENTURE LIMITED

					(Rupees in L	akh Except EP.	
SI. No.	Particulars		uarter Ended		Year Ended		
		31.03.2024	31.12.2023	31.03.2023	31.03.2024	31.03.2023	
		Audited	Unaudited	Audited	Audited	Audited	
1	Income						
a)	Revenue From Operation	101.14	0.00	1.23	116.28	37.27	
b)	Other Income	8.22	20.41	20.51	54.52	39.22	
	Total Revenue :	109.36	20.41	21.74	170.80	76.49	
2	Expenses						
a)	Cost of Masterial Consumed	0.00	0.00	0.00	0.00	0.00	
b)	Purchase of Stock in trade	0.00	0.00	0.85	7.23	64.50	
c)	Change in Inventories of Finished Good	122.53	0.00	0.15	125.29	-28.39	
d)	Work In Progress and Stock in Trade	0.00	0.00	0.00	0.00	0.00	
e)	Employee Benefits Expenses	5.31	6.40	5.33	22.69	21.33	
f)	Depreciation and Amortisation Expenses	0.77	0.00	0.00	0.77	0.00	
g)	Listing Fees	0.00	0.00	0.00	3.25	3.00	
h)	Office Rent	0.00	0.00	1.20	1.20	4.80	
1)	Other Expenses	1.06	5.18	2.07	10.25	7.45	
	Total Expenditure :	129.68	11.58	9.60	170.69	72.69	
3	Total Profit / (Loss) before Exceptional items (1 - 2)	-20.32	8.82	12.14	0.11	3.80	
4	Exceptional items	0.00	0.00	0.00	0.00	0.00	
5	Net Profit / (Loss) before tax (5 - 6)	-20.32	8.82	12.14	0.11	3.80	
6	Tax Expense						
	Current Year Tax	0.20	0.00	0.24	0.20	0.24	
	Earlier Year Tax	0.00	0.00	0.00	0.01	0.00	
	Deferred Tax	0.46	0.00	0.12	0.46	0.12	
	Total Tax Expenses :	0.67	0.00	0.36	0.68	0.36	
7	Net Profit / (Loss) for the period from	-20.98	8.82	11.78	-0.56	3.44	
	continuing operations (5 - 6)						
8	Other Comprehensive Profit / (Loss)						
a)	Amount of items that will not be reclassifiedto	0.00	0.00	0.00	0.00	0.00	
u)	Profit or Loss						
b)	Income tax relating to items that will be	0.00	0.00	0.00	0.00	0.00	
U)	reclassified to profit or Loss	0.00	0.00	0.00	0.00	0.00	
9	Total Comprehensive Profit/(Loss) for	-20.98	8.82	11.78	-0.56	3.44	
9	the period	20.50	0.02		0.50	5.44	
10	Paid - up Equit Share Capital (FV Rs.2/-)	942.50	942.50	942.50	942.50	942.50	
11	Other Equity	3-12.30	5-12.55	5-12.50	-24.63	-24.07	
12	Earnings per Share (EPS)				2-7.03	24.07	
12	- Basic EPS (Rs.)	-0.045	0.019	0.025	-0.001	0.007	
	- Basic EPS (Rs.)	-0.045	0.019	0.025	-0.001	0.007	

Notes:

(1) The above results have been reviewed by the Audit Committee and approved at the meeting of the Board of Directors held on 30th May, 2024 and the statutory auditors of the Company have expressed an unmodified opinion with respect to the Audited Financial Results of the Company for the Quarter and Year neded 31st March, 2024.

(2) The Audited Financial results of the Company for the Quarter and Year Ended 31.03.2024 has been prepared in Accordance with Indian Accounting Standard (Ind A5) notified by Ministry of Corporate Affairs.

(3) The Company is engaged in only one Segment and as such there are no separate reportable segments as per IND AS - 108' Operating Segments.

Operating Segment, (4) Figures of the quarter ended 31st March, 2024 and 31st March, 2023 are the balancing figures between audited figures in respect of the full financial year and the year to date figures upto the third quarter of the relevant financial year which were subjected to limited review by Auditors.

(5) Figures for the Previous periods have been regrouped / rearranged, wherever necessary.

FOR WAGEND INFRA VENTURE LIMITED

S/d- Munnalal Jain DIN: 10478345, Managing Director

बनास फायनान्स लिमिटेड

सीआणलः : L65910MH1983PLC030142 नोंशगीकृत कार्यालयः : ई /१०९, क्रीरटल प्लाहा, ज्ञृतिक तेत्र, दुनिकेटिये जांल्यासार्गाः, ओसी (परिचया), पुंखई – ४०० ०५३, महाराष्ट्र घात इं-सेन आपदी : banafringgmail.com, स्वत्यगहः vww.bastifiance.wordpress.com

(दि. ३१.०३.२०२४ रोजी संपलेली तिमाही व वर्षाकरिताच्या स्थायी व एकत्रित लेखापरीक्षित वित्तीय निष्कर्षांचा सारांश)

			स्थायी		एकत्रित			
34.	तपशील	तिमाहीअखेर	तिमाहीअखेर	वर्षअखेर	तिमाहीअखेर	तिमाहीअखोर	वर्षअखेर	
死.	તપશાલ	39.03.7078	39.03.7073	39.03.7078	39.03.2028	39.03.9093	39.03.7078	
		लेखापरीक्षित	लेखापरीक्षित	लेखापरीक्षित	लेखापरीक्षित	लेखापरीक्षित	लेखापरीक्षित	
٩	परिचालनातून एकूण उत्पन्न	3424.888	1930.334	७३६४.३६३	3424.899	७३०,३३ ५	७३६४.३६३	
ą	कर व अपवादात्मक बाबीपूर्व निव्वळ नफा /तोटा	१५७८.११४	-१४९४.३७४	3353.745	१५७८.११४	-8888.308	3353.745	
3	अपवादात्मक बाबीपश्चात, करपूर्व निव्वळ नफा/(तोटा)	१५७८.११४	-१४९४.३७४	३३६३.२५६	१५७८.११४	-१४९४.३७४	३३६३.२५६	
¥	कर व अपवादात्मक पश्चात निव्वळ नफा /(तोटा)	-१५३२.१८९	३००३.६१६	२२४.८६२	-१५३२.१८९	३००३.६१६	२२४.८६२	
٩	एकूण सर्वसमावेशक उत्पन्न	-१५३२.१८९	३००३.६१६	२२४.८६२	-१५०२.०१२	२९६८.०४०	४०२.१०१	
ξ	प्रदानित समभाग भांडबल	४८०४.६२३	४८०४.६२३	४८०४.६२३	४८०४.६२३	४८०४.६२३	४८०४.६२३	
b	उत्पन्न प्रतिशेअर							
	म्लभूत	-3.869	६.२५ २	0.848	-3.१२६	६,१७७	0.630	
	सीम्बीकृत	-3.869	६.२५ २	0,3%,0	-3.१२६	६,१७७	0.630	

बनाम फाबनान्म लिपिटेड करित सही/-गिरीराज किशोर अग्रवाल संचालक डीआवएन : ००२९०९५९

PIONEER INVESTCORP LIMITED

(CIN : L65990MH184PLC031999) Regd. Office: 1218, Maker Chambers V, Nariman Point, Mumbai 400 021. Tel. no. 022 - 6618 6633 / Fax no. 2204 9195 Website: www.pinc.co.in email.: investor.relations@pinc.co.in

Audited Standalone and Consolidated Financial Results for the quarter and year ended 31st March, 2024.

	(HS. III IAKNS)											
			S	TANDALON	E			С	ONSOLIDAT	ED		
Sr. No.	Particulars	Current quarter ended 31.03.2024 (Unaudited / reviewed)	Previous Quarter ended 31.12.2023 (Unaudited / reviewed)	Quarter ended 31.03.2023 (Unaudited	figures for the current period 31.03.2024	Year to date figures for the previous period ended 31.03.2023 (Audited)	Current quarter ended 31.03.2024 (Unaudited /reviewed	Previous Quarter ended 31.12.2023 (Unaudited / Reviewed)	Previous year Quarter ended 31.03.2023 (Unaudited / reviewed)	Year to date figures for the current period 31.03.2024 (Audited)	Year to date figures for the previous period ended 31.03.2023 (Audited)	
1	Total Income from operations (Net)	855.36	633.35	730.91	2644.97	2360.45	1655.64	863.69	979.98	4101.81	3234.71	
2	Net Profit / (Loss) for the period (before Tax, exceptional and/or extraordinary items)	190.75	53.33	126.55	309.65	214.54	541.64	40.61	167.28	666.06	359.29	
3	Net Profit / (Loss) for the period before Tax, (after exceptional and/or extraordinary items)	190.75	53.33	126.55	309.65	214.54	541,64	40.61	167.28	666.06	359.29	
4	Net Profit / (Loss) for the period after tax (after exceptional and/or extraordinay item)	150.91	39.69	40.95	243.49	115.92	334.12	29.83	26.57	406.96	205.56	
5	Total Comprehensive Income for the period (comprising Profit / (Loss) for the period	(400.70)	37.79	31.32	(38.20)	123.36	47.24	27.08	16.91	127.18	230.03	
6	(after tax) and other comprehensive Income Equity Share Capital	(138.78) 1229.69	1229.69	1229.69	1229.69	1229.69	1229.69	1229.69	1229.69	1229.69	1229.69	
7	Earning Per Share (for continuing and discontuning operations)(of Rs.10/- each)					1220.00						
	Basic Diluted	1.23 1.23	0.32 0.32	0.33 0.33	1.98 1.98	0.94 0.94	2.72 2.72	0.24 0.24	0.22 0.22	3.31 3.31	1.67 1.67	

Note: The allow is an extract of the detailed format of Quarterly Financial Results - as per IND AS compliant filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and C Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly Financial Results are available on Company's velocitie wave pinc.co.in and on the ISES wilestle.

2. The Group is registed primarily in the buriness of Financing and all its operations are in inflax only. Accordingly, there is one reportable segment as per led AS 108 on Operating Segments in respect of the Group.

3. Epiguas portating to previous paraphetics have been re-grouped and re-arranged wherever necessary.

CORRIGENDUM TO THE DETAILED PUBLIC STATEMENT FOR ATTENTION TO THE SHAREHOLDERS OF

OASIS SECURITIES LIMITED

("OSL"/"OASIS"/"TARGET COMPANY"/"TC")
(Corporate Identification No. L51900MH1986PLC041499)
Registered Office: Raja Bahadur Compound, Building No. 5, 2" Floor, 43, Tamarind Lane, Mumbai - 400023.
Phone No.: 022-40463500/01; Email id: admin@pasiscaps.com; Website: www.oasiscaps.com; CAST Desulations 2011 In compliance with Regulations 3 (1) and 4 read with Regulations 15 of the SEBI (SAST) Regulations, 2011

This corrigendum to the detailed public statement is being issued by Navigant Corporate Advisors Limited, on behalf of Mr. Rajesh Kumar Sodhani (Acquirer 1), Mrs. Priya Sodhani (Acquirer 2) and Mr. Gyar Chand Jain (Acquirer 3) in compliance with the Securities and Exchange Board of India (Substantial Acquisition of Shares and Takeovers) Regulations, 2011, as amended (*ESBI (SAST) Regulations) and the SEII (SAST) Regulation with the SEII (SAST) Regulation (SAST) (SAST) and SEII (SAST) Regulation (SAST) (SAST

Update in the schedule of Activities: The original and revised schedule of activities is set forth as below

Activity	Original Date	Original Day	Revised Date	Revised Day
Public Announcement	15.05.2023	Monday	15.05.2023	Monday
Publication of Detailed Public Statement in newspapers	22.05.2023	Monday	22.05.2023	Monday
Submission of Detailed Public Statement to BSE, Target Company & SEBI	22.05.2023	Monday	22.05.2023	Monday
Last date of filing draft letter of offer with SEBI	29.05.2023	Monday	29.05.2023	Monday
Last date for a Competing offer	12.06.2023	Monday	12.06.2023	Monday
Receipt of comments from SEBI on draft letter of offer	19.06.2023	Monday	26.07.2023	Wednesday
Receipt of approval from Reserve Bank of India	N.A.	N.A.	27.05.2024	Monday
Identified date	21.06.2023	Wednesday	29.05.2024	Wednesday
Date by which letter of offer be dispatched to the shareholders	29.06.2023	Thursday	05.06.2024	Wednesday
Last date for revising the Offer Price	05.07.2023	Wednesday	10.06.2024	Monday
Comments from Committee of Independent Directors of Target Company	04.07.2023	Tuesday	10.06.2024	Monday
Advertisement of Schedule of activities for open offer, status of statutory and other approvals in newspapers and sending to SEBI, Stock Exchange and Target Company	05.07.2023	Wednesday	11.06.2024	Tuesday
Date of Opening of the Offer	06.07.2023	Thursday	12.06.2024	Wednesday
Date of Closure of the Offer	19.07.2023	Wednesday	26.06.2024	Wednesday
Post Offer Advertisement	26.07.2023	Wednesday	03.07.2024	Wednesday
Payment of consideration for the acquired shares	02.08.2023	Wednesday	10.07.2024	Wednesday
Final report from Merchant Banker	09.08.2023	Wednesday	18.07.2024	Thursday

Limited report from metronain balancer

2. Update in the Offer Price: The offer price has been initially decided at Rs. 84/- (Rupees Eighty Four Only) per equity share in accordance with Regulation 8 (8) of the SEBI (SAST) Regulations, 2011. Further, in line with SEBI letter dated August 04, 2023, in addition to the offer price mentioned above, the Acquirers shall pay interest @ 10% per annum as prescribed in Regulation 18 (114) of SEBI (SAST) Regulations for any delay in payment beyond the Scheduled Payment Date (piend commencing from the Scheduled Payment Date little actual date of payment of delay in payment beyond the Scheduled Payment Date (lithe actual date of payment of date of payment of the Price has been revised to Rs. 90.50/- (Rupees Kinety and Paisa Fifty only) including interest @ 10% per annum per equity share for delay in payment beyond the Scheduled payment date per fully paid-up Equity Share of Rs. 10 each.

All other terms and conditions remain unchanged. Capitalized terms used in this announcement, but not defined, shall have the same meaning assigned to them in the PA, DPS and LOF.

ISSUED BY MANAGER TO THE OFFER FOR AND ON BEHALF OF THE ACQUIRERS MR. RAJESH KUMAR SODHANI, MRS. PRIYA SODHANI AND MR. GYAN CHAND JAIN



Place: Mumbai Date: May 30, 2024

NAVIGANT CORPORATE ADVISORS LIMITED

804, Meadows, Sahar Plaza Complex, J B Nagar, Andheri Kurla Road, Andheri East, Mumbai - 400059.

Tel No. +91 22 4120 4837 / 4973 5078; Email id: navigant@navigantcorp.com

Website: www.navigantcorp.com; SEBI Registration No: INM000012243

Contact person: Mr. Sarthak Vijlani



PBA INFRASTRUCTURE LTD

Regd office: 611/3, V.N.Purav Marg, Chembur, Mumbai - 400 071 Website: www.bainfra.in Email: pbamumbai@gmail.com Tel: (022) 61277200/01/02 / Fax: (022) 61277203 / CIN: L45200MH1974PLC017653

Extract of the Audited Standalone Financial Results for the Quarter and Year Ended on 31st March, 2024

	[Interns of Regulation 47(1) of the GEDI (Elsting Obligation				Rs in Lakhs
		Quarter	Quarter	Year	Year
Sr.	Particulars	Ended	Ended	Ended	Ended
No.	Faiticulais	31.03.2024	31.03.2023	31.03.2024	31.03.2023
		(Audited)	(Audited)	(Audited)	(Audited)
1	Total Income From Operations	2,267.53	853.33	7,980.20	1,322.47
2	Net Profit / (Loss) for the period (before Tax,				
	Exceptional and/or Extraordinary items)	(200.99)	(766.11)	1,323.05	(9,288.16)
3	Net Profit / (Loss) for the period before tax				
	(after Exceptional and/or Extraordinary items)	(1,360.23)	(506.50)	163.81	(12,828.55)
4	Net Profit / (Loss) for the period after tax				
	(after Exceptional and/or Extraordinary items)	(1,278.66)	(1,125.65)	245.39	(13,447.70)
5	Total Comprehensive Income for the period				
	[Comprising Profit/(Loss) for the period (after tax)				
	and Other Comprehensive Income (after tax)]	-	14	-	-
6	Equity Share Capital	1,350.05	1,350.05	1,350.05	1,350.05
7	Reserves (excluding Revaluation Reserve as				
	shown in the Balance Sheet of previous year)			-	-
8	Earnings Per Share				
	(before and after extraordinary items)				
	(Face value of Rs. 10/- each)				
	(a) Basic (Rs.)	(9.47)	(8.34)	1.82	(99.61)
	(b) Diluted (Rs.)	(9.47)	(8.34)	1.82	(99.61)

Notes:

1. The above results have been reviewed by Audit Committee and Approved by the Board of Direct at their meeting held on 30/05/2024

as unem investing inextent present pre

For and on behalf of the Board of Directors Sd/ Narain P. Belan

GANESH BENZOPLAST LIMITED

Regd. Office: Dina Building, 1st Floor, 53, Maharshi Karve Road, Marine Lines (East), Mumbai 400 002.

CIN: L24200MH1986PLC039836 Telefax: 022-22001928 e-mail: investors@gblinfra.com web-site: www.ganeshbenzoplast.com

EXTRACT OF STATEMENT OF AUDITED STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2024

₹ in Millions (Except EPS)												
		STANDALONE					CONSOLIDATED					
Sr No		Quarter Ended			Year Ended		Quarter Ended			Year Ended		
		31.03.2024	31.12.2023	31.03.2023	31.03.2024	31.03.2023	31.03.2024	31.12.2023	31.03.2023	31.03.2024	31.03.2023	
		AUDITED	UNAUDITED	AUDITED	AUDITED	AUDITED	AUDITED	UNAUDITED	AUDITED	AUDITED	AUDITED	
1	Total Income From Operations	602.47	590.29	517.84	2,267.15	1,926.92	1,462.64	1,061.96	1,340.67	4,770.77	4,208.48	
2	Net Profit for the period (before tax and Exceptional items)	220.51	208.82	167.42	815.73	684.88	208.96	208.04	199.76	839.91	745.57	
3	Net Profit for the period (before tax and after Exceptional items)	220.51	208.82	164.21	815.73	681.66	208.96	208.04	196.51	839.91	742.32	
4	Net Profit for the period (after tax and after Exceptional items)	161.89	157.93	122.60	606.25	509.37	142.91	160.80	147.47	614.41	550.79	
5	Total Comprehensive Income for the period	165.37	157.17	122.27	609.47	507.77	146.18	159.48	147.13	616.86	548.96	
6	Equity Share Capital (Face value of Re. 1/- each)	71.99	68.11	65.18	71.99	65.18	71.99	68.11	65.18	71.99	65.18	
7	Reserve excluding Revaluation reserves as shown in the audited balance sheet				4,922.80	3,483.00				4,944.17	3,503.31	
8	Earning Per Share (of Re. 1/- each) (not annualised) (after Exceptional items)											
	a) Basic	2.30	2.31	1.88	8.95	8.08	2.03	2.34	2.44	9.07	8.73	
	b) Diluted	2.30	2.31	1.85	8.95	7.93	2.03	2.34	2.40	9.07	8.57	

Place : Mumbai Date : May 25, 2024

te:
The above is an extract of the detailed format of Financial Results for the Quarter and year ended on March 31, 2024 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Audited Financial Results are available on the Company's website, www.ganeshbenzoplast.com and and Stock Exchanges website, www.bseindia.com and www.nseindia.com.
The above financial results have been reviewd and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at their meeting held

By Order of the Board of Directors For Ganesh Benzoplast Limited

Sd/-(Rishi Pilani) Chairman & Managing Director (DIN 00901627)

દસમા ધોરણના વિદ્યાર્થીઓને 'મુંબઈ સમાચાર' તરફથી અભિનંદન



૯૭.૪૦ ટકા



જશ રાજેન શાહ ૯૮.૨૦ ટકા



કાર્તિક જિતેન પટેલ





185 OY. YE



વંશિકા અજય ફૂલિયા 29 00 29I



ધૈર્ય ચિરાગ શાહ 63 20 28



८७.८० टडा



હર્ષ ભાનુશાલી ૯૧.૨૦ ટકા

ખુશી મુકેશ ભાનુશાલી

185 03.09

નીર નીતીન ભાનુશાલી

પ્રણવ ભારદ્વાજ

સ્નેહ પટેલ

૭૨.૬૭ ટકા



185 05.85

ग्रायहवार आहित्य गोविंह





પાર્થ મેહુલ ધાનકી



માર પ્રિશા ધીરે મયંક પરમાર







સ્મિત બિપીન ખપ

63.00 टअ

પ્રિયાંશી રણછોડ મંગે

८३.४० ८५।



૮૨.૧૭ ટકા



८६.०० टडा

મહારાષ્ટ્ર બોર્ડના દસમા અને બારમા ધોરણના ૮૦%થી વધુ માર્ક મેળવનાર વિદ્યાર્થીઓ પોતાનો ફોટો અને માર્કશીટ 'મુંબઈ સમાચાર'ને મોકલી આપે.

ઈ–મેઈલ એડ્રેસ : resultonms@gmail.com

વૉટ્સઍપ: 7045430579

આવ્હાડ વિરુદ્ધ ભાજપનું આંદોલન બાબાસાહેબ આંબેડકરનાં ચિત્રો ફાડવાનો વિવાદ

મુંબઈઃ એનસીપી(શરદચંદ્ર પવાર)ના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડ દ્વારા આંબેડકરનો કોટો ધરાવતા પોસ્ટર કાડ્યા હતા. જેને પંગલે ગુરુવારે ભાજપ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યું હોવાનો આરોપ મૂકીને આવ્હાડ વિરૃદ્ધ આંદોલન કરવામાં આવ્યું

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન રહી ચકેલા આવરાંડ પોતે કરેલા ફ્રેત્ય બદલ બુધવારે માફી માગી હતી. સરકાર કથિતપણે શાળાઓમાં મનુસ્મૃતિના અમુક શ્લોક શીખવવાની યોજના બનાવી રહી હોવાનો આરોપ મુકીને આવ્હાડ દ્વારા રાયગઢ ખાતે મોરચો કાઢવામાં આવ્યો હતો. આવ્હાડ લોકોને સરકારની આ યોજનાનો વિરોધ કરવાનું આહ્વાન કર્યું હતું. જોકે વિરોધ દરમિયાન આંબેડકરનો કોટો ધરાવતા

પોસ્ટર ફાડવામાં આવ્યા હતા. આવ્હાડ પોતે જ આંબેડકરનો ફોટો ધરાવતા પોસ્ટર બુધવારે મનુસ્મૃતિનું દહેન કરવા માટે મોરચો કાડી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થતા કાઢવામાં આવ્યો ત્યારે ડૉ.બાબાસાહેબ મોટો વિવાદ ઊભો થયો હતો. જેને પગલે ભાજપ દ્વારા મુંબઈ, નાગપુર અને થાણે સહિત રાજ્યભરમાં વિવિધ સ્થળે આવ્હાડ વિરુદ્ધ આંદોલન કરવામાં આવ્યું હતું. આ વિવાદને પગલે ભાજપના પદાધિકારી દ્વારા પુણેના બંડગાર્ડનમાં આવ્હાડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. જોકે આવ્યાડ બાબાસાહેબના પોસ્ટર કાડ્યા બાદ શરદ પવાર જૂથની એનસીપીના નેતાઓ આવ્હાડના બચાવમાં કદી પડ્યા હતા. શરદ પવાર જૂથના મહારાષ્ટ્ર અધ્યક્ષ જયંત પાટીલે એક્સ(પહેલા ટિવટર) પર આવ્હાડનો બચાવ કરતા જણાવ્યું હતું કે આવ્હાડ ડૉ.આંબેડકરના ઉપદેશોના સંરક્ષણ માટે સતત કાર્યરત રહ્યા છે અને ડૉ.આંબેડકર પ્રત્યે તેમની નિષ્ઠા અંગે કોઇ



हे**न्य अनटीस डेथ?:** 30भी भेना पर्ल्ड नो टोબेडो डे निभित्ते मुंબઈना हाहरमां आपेसा . શિવાજીપાર્ક ખાતે ઝાડ પર આ રીતે સિગારેટને લટકાવીને ધૂમ્રપાનના વ્યસનીઓને ધૂમ્રપાનથી દૂર કરવા માટે કોઈ સ્પેશિયલ કેમ્પેઈન હાથ ધરવામાં આવ્યું હોય એવી અનુભૂતિ થઈ રીતે છે.

પાલઘરમાં કુઠાડીના ઘા HPCL એ ગ્રીન H₂ જનરેશન માટે ભારતનું પ્રથમ ઉચ્ચ ઝીંકી પત્નીની હત્યા

શંકા નથી

પાલઘરઃ પાલઘર જિલ્લામાં ચારિત્ર્ય પર શંકાને લઇ થયેલા ઝઘડામાં કૃહાડીના ઘા ઝીંકી પત્નીની હત્યા કરવા બદલ પતિની ધરપકડ કરવામાં આવી હતી.

યરપક્ડ કરવાના આવા હતા. મનોર વિસ્તારના દરવેશ ગામમાં બુધવારે આ ઘટના બની હતી. આરોપી તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો, જેને કારણે દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા

.. ુ.... બુધવારે ફરી આ બાબતને લઇ દંપતી વચ્ચે ઝઘડો થયો હતો, જે ઉગ્ર બનતાં આરોપીએ પત્ની પર કુહાડીના ઘા ઝીંકી દીધા હતા. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી પત્નીનું ઘટનાસ્થળે મોત થયું હતું. દરમિયાન બનાવની જાણ થતાં મનોર પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. (પીટીઆઇ) 🔳

કાર્યક્ષમ "સોલિક ઓક્સાઈક ઈલેક્ટ્રોલાઈઝર" શરૂ કર્યું

મુંબઈ: હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. એ ગ્રીન ઇમ્પ્રેગ્રેલ્ય (GH2) જનદેશન માટે તેના HP ગ્રીન આર એન્ડ ડી સેન્ટર, બેંગલુરૂ ખાતે ઈલેક્ટ્રોડ્સ/ઈલેક્ટ્રોલાઈટ્સ માટે દુર્લભ ભારતનું પ્રથમ સોલિડ ઓક્સાઈડ આંઘારિત પૃથ્વી સામગ્રીનો ઉપયોગ કરતું નથી. વધુમાં

ઈલેક્ટ્રોલાઈઝર (SOE) સફળતાપૂર્વક કાર્યરત કર્યું છે. આ અત્યંત કાર્યક્ષમ પાયલોટ-સ્કેલ ઈલેક્ટ્રોલાઈઝર ૯૯.૯૯% શુદ્ધતા સાથે ગ્રીન હાઈડ્રોજન પેદા કરી શકે છે. તેના પ્રકારની સૌપ્રથમ SOE સિસ્ટમ 20 KW સોલિડ ઓક્સાઈડ ઈલેક્ટોલાઈઝર સ્ટેકનો ઉપયોગ કરીને કેપ્ટિવ સોલાર+વિન્ડ પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન થતી વીજળીમાંથી ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન કરે છે. SOEC કાર્યરત કરાયેલી વિશિષ્ટ વિશેષતાઓમાંની એક એ છે કે, તે

ઊર્જાનો વપરાશ અન્ય ઈલેક્ટ્રોલાઈઝર તકનીકો કરતાં લગભગ 20-30%

તકનાક કરતા લગભગ 20-30% ઓછો છે. આ SOE સિસ્ટમની ક્રેપોજ્જ પર, HP ગ્રીન આર એન્ડ ડી સેન્ટર હાઈડ્રોજન જનરેશન માટે દિફાઈનરીઓમાંથી નીચી ગુણવતાની વરાળ/કચરી ઉપ્પાનો ઉપયોગ, સિન-ગેસ અને ઈ-ઈંઘણનું ઉત્પાદન કરતા સહ-ઈલેક્ટોલિસિસ માર્ગ દ્વારા કાર્બન કેપ્ચર કરવાના ક્ષેત્રોમાં સંશોધન હાથ ધરશે. 🔳

ુદકાળની સ્થિતિમાં કૃષિ પ્રધાન વિદેશ ચાલ્યા ગયા

ધનંજય મુંડેના વિદેશ પ્રવાસ પર કૉંગ્રેસનો નિશાનો

મુંબઈઃ કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે મહારાષ્ટ્રના કૃષિ પ્રધાન ધનંજય મુંડેના વિદેશ પ્રવાસ પર નિશાન સાધ્યું હતું. દુકાળગ્રસ્ત જાલનાની મુલાકાતે જતા પહેલા પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે મુંડની ટીકા કરતા કહ્યું હતું કે રાજ્યમાં ખેડૂતો દુકાળથી ત્રસ્ત છે ત્યારે મહારાષ્ટ્રના કૃષિ પ્રધાન ધનંજય મુંડે વિદેશમાં છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વડેક્રીવારે કહ્યું

મહારાષ્ટ્ર ાવધાનતાનાના વિરાધ પત્રના નતા વડાકાયર કહ્યું હતું કે મરાઠવાડામાં ૨૬૭ ખેડૂતોએ છેલ્લા ત્રણ મહિનામાં આત્મહત્યા કરી છે. કૃપિ પ્રધાને આ મહિને ખેડૂતો પાસે ભિયગરણ, પાક, ખાતર છે કે નહીં તેની સમીક્ષા કરવી જોઇએ, પરંતુ તે તો ખેડૂતોને કુકાળનો સામનો કરવા મૂકીને વિદેશ ચાલ્યા ગયા છે જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. ચૂંટણીના કારણે આચારસંહિતા લાગુ છે એમ કહી સરકાર લોકો અને ખેડૂતોને ઉલ્લું બનાવી રહી છે ત્યારે બીજી બાજુ ચૂંટણી પંચ પાસેથી પરવાનગી લઇ તેમણે ૨ ૫,૦૦૦ કરોડ રૂપિયાના ટેન્ડર બહાર પાડી લીધા છે, એમ કહીને વડેટ્ટીવારે સરકારની ટીકા કરી હતી.

પાણીની અછતઃ ઇલોરા ગુફાઓ, અન્ય સ્મારકો ટેન્કર પર નિર્ભર

સંભાજનગરમાં આવેલી વિશ્વ વિખ્યાત ઈલોરા ગુફાઓ અને અન્ય વિવિધ સ્મારકો ગયા ચોમાસામાં ઓછા વરસાદને કારણે પાણીના પુરવઠા માટે ટેન્કરો

છત્રપતિ સંભાજીનગરમાં ગત ચોમાસાની સીઝનમાં ૫૨૭.૧૦ મીમી વરસાદ નોંધાયો હતો, જે આ સમયગાળા માટે સરેરાશ ૬૩૭.૫૦ મીમી વરસાદની સરખામણીમાં ઓછો હતો, એમ અહીંના વસ્સાઈના સરનાન્યુતાના આઇના હતા, અને અહાતા એક મહેસૂલ અધિકારીએ જણાવ્યું હતું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે વરસાદ ધાર્યા કરતા ઓછો હતો. પરિણામે, ઇલોરા ગુફાઓ, યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ,

છત્રપતિ સંભાજીનગરઃ મહારાષ્ટ્રના છત્રપતિ 🔝 ગયા છે . સ્મારકો, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે અને હવે પાણી પુરવઠા માટે ટેન્કરો પર નિર્ભર છે. અધિકારીએ જણાવ્યું હતું કે, ઇલોરા ગુફાઓ સંકુલને પીવા, બાગકામ અને ધોવા માટે દરરોજ બે પાણીના ટેન્કરની જરૂર પડે છે. અમે બીબી કા મકબરા માટે ૫,૦૦૦ લિટરના ઓછામાં ઓછા બે ટેન્કર અને ઔરંગાબાદ ગુફાઓમાં દર વૈકલ્પિક દિવસે એક ટેન્કર ખરીદી રહ્યા છીએ.

જો પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય તો ક્યારેક બીબી કા મકબરામાં ત્રીજા પાણીના ટેન્કરની પણ જરૂર પડે છે. ત્યાં એક અલગ ટાંકી શુદ્ધિકરણ સિસ્ટમ સાથે જોડાયેલ છે. ટાંકી ભરીને હોલાં કુરાના, કુરાના, કુરાના, કુરાના કરાકારા કરાકારો કરાકારા કરાકારા કરાકારા કરાકારા કરો છે. બીબી કા મકબરા અને ઔરંગાબાદની ગુફાઓ જેવા મુલાકાતીઓ માટે તેના પાણીનો ઉપયોગ કરીએ કેટલાક સ્મારકોના પરિસરમાં પાણીના સ્ત્રોત સુકાઈ છીએ, તેમણે કહ્યું.

સચિન વઝેની જામીન અરજી પર હાઈ કોર્ટે સીબીઆઈનો જવાબ માગ્યો

સહાયક પોલીસ નિરીક્ષક સચિન વર્ઝ દ્વારા કર્યો હતો કે તે બે વર્ષથી જેલમાં છે અને તેમની દાખલ કરવામાં આવેલી અરજીમાં બોમ્બે હાઈ સામે કોઈ ચાર્જશીટ દાખલ કરવામાં આવી નથી કોર્ટે બુધવારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન અને તેથી તેમને હાલની જોગવાઈઓ હેઠળ (સીબીઆઈ) ને નોટિસ જારી કરી હતી. ડિફોલ્ટ જામીન આપવામાં આવે. તેમણે સર્વોચ્ચ

૩૦૬(૪)(બી) ની બંધારણીયતાને પડકારી છે, જે આદેશ આપે છે કે માફી આપવામાં ર્બાવેલ વ્યક્તિ ટ્રાયલ પૂર્ણ ન થોય ત્યાં સુધી બંનેના ફાયદાઓથી વંચિત રહે છે

મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન કે તેમની અટકાયત ગેરબંધારણીય છે, કારણ કે અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસમાં તેમને જૂન ૨૦૨૨ માં મુંબઈની દ્રાયલ કોર્ટ તેમની અન્યાયી અટકાયતને પડકારતી ભૂતપૂર્વ દ્વારા માફી આપવામાં આવી હતી. તેમણે દાવો વઝેએ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ અદાલતના અનેક દાખલાઓ ટાંક્યા અને ભારપૂર્વક જણાવ્યું કે, કાયદાનો હેતુ આઝાદીને નાબૂદ કરવાનો અથવા પ્રતિબંધિત કરવાનો નથી, પરંતુ સ્વતંત્રતાને સાચવવા અને વિસ્તૃત કરવાનો અટકાયતમાં રહે છે તેથી આરોપી અને સાક્ષી છે.દલીલો બાદ ખંડપીઠે નોટિસ જારી કરવાનો તેના ફાયદાઓથી વંચિત રહે છે . િનદેશ આપ્યો હતો અને અરજીની સુનાવણી તેમની અરજીમાં, વાઝેએ દલીલ કરી હતી. ૧૪ જૂન સુધી મુલતવી રાખી હતી. ■

વિક્રોલીમાં બિલ્ડિંગનો હિસ્સો તૂટી પડતા બે સિનિચર સિટિઝનનાં મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ વિક્રોલી (પૂર્વ) કન્નમવાર નગર એકમાં ગ્રાઉન્ડ ત્રણ માળની બિલિંડગમાં ત્રીજા માળનો સ્લેબ તૂટી પ્લસ ત્રણ માળના ભાલ્ડગમા ત્રાજા માળના સ્વાન પૂર્વ પડતા બે સિનિયર સિટિઝનનું મૃત્યુ થયા હોવાની દુર્ઘટના બની હતી.ડિઝાસ્ટર મેનેજમેન્ટને જણાવ્યા મુજબ કન્નમવાર નગર એકમાં રમાબાઈ આંબેડકર ઉદ્યાન નજીક મ્હાડાની ૪૦ નંબરની ગુરુકૃષા કૉ–ઓ-હાઉસિંગ સોસાયટી નામની ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની બિલ્ડિંગ

Place : Mumbai Date : May 25, 2024

આવેલી છે. ગુરુવારે સાંજના ૬.૫૦ વાગ્યાની આસપાસ ત્રીજા માળા પર સ્લેબ તટી પડ્યો હતો. જેની નીચે ૭૫ વર્ષના શરદ મ્હાસલેકર અને ૭૮ વર્ષના સુરેશ મઢાલકર ફસાઈ ગયા હતા. ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બંને સિનિયર સિટિઝનને બહાર કાઢ્યા હતા. તેમને તુરંત નજીક આવેલી આંબેડકર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બંન સિનિયિર સિટિઝનને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

ભ્રષ્ટાચાર બદલ ભારતીય સેનાના અધિકારી અને ક્લર્ક વિરુદ્ધ ગુનો દાખલ મુંબઈઃ ભ્રષ્ટાચાર બદલ ભારતીય ખોટી રીતે લાભ પ્રાપ્ત કરવાનો આરોપ

સેનાના લેફ્ટનન્ટ કર્નલ અને સર્ધન કમાન્ડ, સામાં વસ્ટાગર કર્યાં અંતિસ કાર્યો, પુણેના ભૂતપૂર્વ કલર્ક/હવાલદાર વિરુદ્ધ સીબીઆઇએ ગુનો દાખલ કર્યો હતો. નોકરીવાંચ્છુઓને તેમની પસંદગી પ્રક્રિયા અને યુનિટ એસાઇનમેન્ટ્સનાં કામો પાર પાડવાની તેમણે ખાતરી આપી હતી. બંને વિરુદ્ધ છેતરપિંડી, ફોજદારી કાવતરું અને

છે. આ ઘટના ૨૦૨૧માં બની હતી. ભૂતપૂર્વ હવાલદાર વિરુદ્ધ લાંચનો કેસ ચાલતો હતો. નવેમ્બર, ૨૦૨૧માં મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ પોઝિશન માટે પોસ્ટિંગની વિધિ પૂરી કરવા માટે હવાલદાર સહિત બે આરોપીએ ખોટી

GANESH BENZOPLAST LIMITED Regd. Office: Dina Building, 1st Floor, 53, Maharshi Karve Road, Marine Lines (East), Mumbai 400 002.

CIN: L24200MH1986PLC039836 Telefax: 022-22001928 e-mail: investors@gblinfra.com web-site: www.ganeshbenzoplast.co

EXTRACT OF STATEMENT OF AUDITED STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2024												
₹ in Millions (Except EPS)												
Sr No	Particulars		STAN	DALONE			CONSOLIDATED					
		Quarter Ended			Year Ended		Quarter Ended			Year Ended		
		31.03.2024	31.12.2023	31.03.2023	31.03.2024	31.03.2023	31.03.2024	31.12.2023	31.03.2023	31.03.2024	31.03.2023	
		AUDITED	UNAUDITED	AUDITED	AUDITED	AUDITED	AUDITED	UNAUDITED	AUDITED	AUDITED	AUDITED	
1	Total Income From Operations	602.47	590.29	517.84	2,267.15	1,926.92	1,462.64	1,061.96	1,340.67	4,770.77	4,208.48	
2	Net Profit for the period (before tax and Exceptional items)	220.51	208.82	167.42	815.73	684.88	208.96	208.04	199.76	839.91	745.57	
3	Net Profit for the period (before tax and after Exceptional items)	220.51	208.82	164.21	815.73	681.66	208.96	208.04	196.51	839.91	742.32	
4	Net Profit for the period (after tax and after Exceptional items)	161.89	157.93	122.60	606.25	509.37	142.91	160.80	147.47	614.41	550.79	
5	Total Comprehensive Income for the period	165.37	157.17	122.27	609.47	507.77	146.18	159.48	147.13	616.86	548.96	
6	Equity Share Capital (Face value of Re. 1/- each)	71.99	68.11	65.18	71.99	65.18	71.99	68.11	65.18	71.99	65.18	
7	Reserve excluding Revaluation reserves as shown in the audited balance sheet				4,922.80	3,483.00				4,944.17	3,503.31	
8	Earning Per Share (of Re. 1/- each) (not annualised) (after Exceptional items)											
	a) Basic	2.30	2.31	1.88	8.95	8.08	2.03	2.34	2.44	9.07	8.73	
1	b) Diluted	2.20	2.21	1.05	9.05	7.02	2.02	2.24	2.40	0.07	0.67	

above is an extract of the detailed format of Financial Results for the Quarter and year ended on March 31, 2024 filed with the SI ng and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Audited Financial Results are available on the CI and Slock Exchanges website, www.besindia.com.and www.nseindia.com.

પુણેમાં કાર અકસ્માત

टीनेषरना सोहीना नभूना भहिसाना લોઠી સાથે બદલવામાં આવ્યાઃ પોલીસ



જીવન મળવું એ નસીબની વાત છે, મૃત્યુ મળવું એ સમયની વાત છે, પણ મૃત્યુ પછી પણ સૌના હૃદયમાં જીવંત રહેવું એ જીવનમાં કરેલા સત્કર્મોની વાત છે.

PACK-O-MATIC Family

પુણેઃ પુણેમાં પોર્શે કાર હંકારીને બે સોફ્ટવેર એન્જિનિયરને કચડી નાખનારા ટીનેજરે ઘટના સમયે દારૂ પીધો ન હોવાનું બતાવવા માટે તેના લોહીના નમૂના મહિલાના લોહી સાથે બદલવામાં આવ્યા

હતા, એમ પોલીસે ગુરુવારે કોર્ટને જણાવ્યું હતું. સેશન્સ કોર્ટે પોલીસની અરજી મંજૂર કરી હતી અને આ કેસમાં ધરપકડ કરાયેલા સસૂન જનરલ હોસ્પિટલના બે ડોક્ટર અને

કર્મચારીની પોલીસ કસ્ટડી ૫ જૂન સુધી લંબાવી હતી. પોલીસે કોર્ટને કહ્યું હતું કે ટીનેજરના લોહીના નમૂના જે મહિલાના લોડી સાથે બદલવામાં આવ્યા હતા, એ મહિલાને તેઓ ઓળખવા માગે છે. બીજી તરફ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે એ મહિલા અન્ય કોઇ નહીં, પણ ટીનેજરની માતા હતી.

અપ્ય ૩૦ પછે, ખુબ દરખ્કરના ત્યાદ હતા. પોર્શે કાર અકસ્માત બાદ રિયલ એસ્ટેટ ડેવલપરના સગીર પુત્રને બચાવવા માટે તેના લોહીના નમૂના બદલી નાખવા બદલ સસૂન હોસ્પિટલના ફોરેન્સિક મેડિસીન વિભાગના પ્રમુખ ડો. અજય તાવરે, મેડિકલ ઓફિસર ડો. શ્રીહરિ હાલનોર અને હોસ્પિટલના કર્મચારી અતલ ઘાટકાંબળેની ધરપકડ કરવામાં આવી હતી.

